

ધાન્યપાકો

ઘઉં

પ્રશ્ન : પિયત ઘઉની કઈ જાતોનું વાવેતર કરવું?

જવાબ : ઘઉના સમયસર વાવેતર માટે : જી.ડબલ્યુ. ૩૬૬, જી.ડબલ્યુ. ૪૬૬, જી.ડબલ્યુ. ૩૨૨,
જી.ડબલ્યુ. ૨૭૩, તથા લોક ૧

મોડા વાવેતર માટે : જી.ડબલ્યુ. ૧૭૩ તથા લોક ૧

વહેલા વાવેતર માટે : જી.ડબલ્યુ. ૧૮૦

પ્રશ્ન : બિન પિયત ઘઉના વાવેતર માટે સુધારેલ જાતો કઈ?

જવાબ : બિન પિયત ઘઉના વાવેતર માટે સુધારેલ જાતો : જી. ડબલ્યુ. ૧ અને જી. ડબલ્યુ. ૨

પ્રશ્ન : ખારાશવાળી જમીન હોય તો ઘઉના વાવેતર માટે કઈ જાત પસંદ કરવી ?

જવાબ : ખારાશવાળી જમીન હોય તો ઘઉના વાવેતર માટે લોક ૧ અને રાજ ૩૦૭૭ જાત પસંદ કરવી.

પ્રશ્ન : ઘઉના વાવેતર માટે નો યોગ્ય સમય જણાવો?

જવાબ : ઘઉનું વાવેતર નીચે મુજબ કરવાની ભલામજા છે.

૧. સમયસરનું વાવેતર — ૧૦ નવેમ્બર થી ૨૫ નવેમ્બર

૨. મોહું વાવેતર — ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર

૩. વહેલું વાવેતર — ૧૦ નવેમ્બર પહેલા

નોંધ : ઘઉનું સમયસર વાવેતર કરવાથી સૌથી વધુ ઉત્પાદન આવે છે.

પ્રશ્ન : ઘઉનું વાવેતર કરવા માટે કેટલું અંતર રાખવું જોઈએ?

જવાબ : ઘઉનું વાવેતર કરવા માટે બે હાર વચ્ચે ૮ ઈચ્છનું અંતર રાખી ટ્રેકટર અથવા બળદથી ઓટોમેટીક વાવણીયાથી કરવું.

પ્રશ્ન : ઘઉનું વાવેતર કેવી રીતે કરવું ?

જવાબ : ઘઉનું વાવેતર બે હાર વચ્ચે ૮ ઈચ્છનું અંતર રાખી ટ્રેકટર અથવા બળદથી ઓટોમેટીક વાવણીયાથી કરવું.

પ્રશ્ન : ઘઉના વાવેતર માટે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ ?

જવાબ : — ઘઉના મોડા દાખાવાળી જાતો જેવી કે, લોક ૧, જી ડબલ્યુ. ૩૬૬, જી ડબલ્યુ. ૧૧૩૮,
એચ આઈ ૮૪૮૮ માટે હેકટરે ૧૨૦ થી ૧૨૫ કિગ્રા બીજ દર રાખવો

-
- ધરુના મધ્યમ દાખાવાળી જાતો જેવી કે, જી ડબલ્યું ૪૮૬, જી ડબલ્યું ૨૭૩, જી ડબલ્યું ૩૨૨, જી ડબલ્યું ૩૬૬, જી ડબલ્યું ૧૮૦, જી ડબલ્યું ૧૭૩ માટે હેકટરે ૧૦૦ કિગ્રા બીજ દર રાખવો
 - બીજનિયત ધરુના માટે: બિયારણનો દર ૫૦ કિગ્રા પ્રતિ હેકટર મુજબ રાખવો જોઈએ

પ્રશ્ન : ધરુના પાકમાં રાસાયણીક ખાતર કયારે અને કેટલું આપવું ?

જવાબ: ધરુના પાકને એક હેકટરે નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ તત્વ અનુક્રમે ૧૨૦ – ૬૦ – ૪૦ કિ.ગ્રા. આપવું. તે પૈકી વાવેતરના સમયે એટલે કે પાયાના ખાતર તરીકે અડધો જથ્થો નાઈટ્રોજનનો અને પુરેપુરો જથ્થો ફોસ્ફરસનો (૧૩૦ કિગ્રા ડીઓપી અને ૮૦ કિગ્રા યુરીયા પૂર્તિ હેકટરે) આપવો. જમીનમાં પોટાશ તત્વની ઉણાય જણાય તો ઘુરેટ ઓફ પોટાશ હેકટરે ૨૫ કિગ્રા પ્રમાણે આપવું.

પ્રશ્ન : ધરુના પાકમાં પુર્તિ ખાતર કયારે અને કેટલું આપવું ?

જવાબ: ધરુના પાકમાં વાવેતર બાદ ૧૮ થી ૨૧ દિવસે એટલે કે મુકૃટ મૂળ અવસ્થાએ પિયત આપ્યા બાદ બાકી રહેતો નાઈટ્રોજનનો અડધો જથ્થો (૧૩૦ કિગ્રા યુરીયા પ્રતિ હેકટર) આપવો.

પ્રશ્ન : ધરુના પાકમાં નિયંત્રણ માટેના ઉપાયો જણાવો.

જવાબ: ધરુના પાકમાં હાથથી નિયંત્રણ કરવું હિતાવહ છે. આમ છતાં, મજુરની અછિત જણાય તો ધરુની વાવણી બાદ બીજના સ્હૂરણ પહેલા(પ્રિ ઈમરજન્સ છંટકાવ) પેન્ડીમિથાલીન દવા ૧૦ લિટર પાણીમાં ૫૫ મિલિ પ્રમાણે ઓગાળી છંટકાવ કરવો.

પ્રશ્ન : ધરુના પાકમાં પિયત કયારે આપવા.

જવાબ: સામાન્ય રીતે ધરુના પાક ને ૧૦ થી ૧૨ પિયત ની જરૂરીયાત રહેતી હોય છે. આમ છતાં, ધરુની કટોકટી અવસ્થાઓ જેવી કે, (૧) મુકૃટ મૂળ અવસ્થા (૨) ફૂટ અવસ્થા (૩) ગાંભે આવવાની અવસ્થા (૪) ફૂલ અવસ્થા (૫) દુધીયા દાખા અવસ્થા (૬) પોક અવસ્થાએ દરમ્યાન પિયત આપવા ખાસ જરૂરી છે.

પ્રશ્ન : ધરુના પાકમાં ઉધી નું નિયંત્રણ કરી રીતે કરવું ?

જવાબ: ૧. બીજ માવજત દવારા:

ધરુના બીજને વાવેતરના આગલા દિવસે એન્ડોસલ્ફાન ઉપ ઈસી ૭૦૦મિલિ દવા ૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી ૧૦૦ કિગ્રા બીજ ને માવજત આપવી.

૨. ઉભા પાક માટે:

ઘઉના ઉભા પાકમાં હેક્ટરે ૨.૩ લિટર એન્ડોસલ્ફાન તપ ઈસી દવા ૫ લિટર પાણી માં મિશ્રણ કરી, ૧૦૦ કિગ્રા રેતી માં બેળવી ખેતરમાં પુંખી હળવું પિયત આપવું.

પ્રશ્ન : ઘઉના પાકમાં ખપૈડી નું નિયંત્રણ કઈ રીતે કરવું ?

જવાબ : ઘઉના પાકમાં ખપૈડીનાં નિયંત્રણ માટે મિથાઈલ પેરાથીઓન ૨ ટકા અથવા ફેનવલરેટ ૦.૪ ટકા ભૂકી દવાનો પ્રતિ હેક્ટરે ૨૫ કિગ્રા પ્રમાણે છંટકાવ કરવો.

પ્રશ્ન : ઘઉના પાકમાં ગેડુ રોગના નિયંત્રણ માટે શું કરવું ?

જવાબ : રોગ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. નવી સુધારેલ જાતો રોગ પ્રતિકારક હોઈ આ જાતોનું વાવેતર કરવું. આમ છતાં રોગનો ઉપદ્રવ જણાય તો તેના નિયંત્રણ માટે જાયનેબ ૦.૨ ટકા દ્રાવકા ના ૧૫ દિવસ ના અંતરે ત્રણ છંટકાવ કરવા.

પ્રશ્ન : ઘઉના દાઢા પર કાળી ટપકી અટકાવવાના ઉપાય જણાવો.

જવાબ : ઘઉની પોક અવસ્થાએ મેન્કોજેબ ૨૫ થી ૩૦ ગ્રામ અથવા કલોરોથેલોનીલ ૨૫ ગ્રામ દવા ૧૦ લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

પ્રશ્ન : ઘઉના પાકની કાપણી સમયે શું કાળજી રાખવી જાઈએ.

જવાબ : પાક પરિપક્વ થયે સમયસર કાપણી કરવાથી છોડ ઢળી પડવાથી કે દાઢા ખરી જવાથી થતો બગાડ અટકાવી શકાય છે.

પ્રશ્ન : ઘઉ દાઢાનો સંગ્રહ કેવી રીતે કરવો.

જવાબ : ઘઉના સંગ્રહ દરમ્યાન જીવાત થી રક્ષણ મેળવવા, દાઢાને કોથળા કે કોઠારમા સંગ્રહ કરતા પહેલા તેમાં ૮ થી ૧૦ ટકા કરતા ઓછો બેજ રહે તે રીતે સુર્યપ્રકાશમાં સુકવણી કરી સંગ્રહ કરવો.

પ્રશ્ન : ઘઉ નું મહત્તમ ઉત્પાદન મેળવવા શું કરવું ?

જવાબ : ઘઉ નું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે નીચે મુજબની કાળજી લેવી

૧. ઘઉની સુધારેલ જાતો વાવેતર માટે પસંદ કરવી
૨. પાકની સમયસર વાવણી ભલામણ મુજબના અંતરે એટલે કે ૨૨.૫ સેમી એ કરવી
૩. ભલામણ મુજબ બીજ દર રાખી વાવેતર કરવું
૪. ભલામણ મુજબ રાસાયણિક ખાતર યોગ્ય સમયે આપવું.
૫. પાકની કટોકટી અવસ્થાએ અચૂક પિયત આપવા.
૬. સમયસર નિંદામણ કરવું.

૭. જમીનનું રાસાયણિક પૃથ્વેકરણ કરાવી, સુક્ષમતત્વો ની ઉશ્રાપ જણાય તો ઉમેરવા.

પ્રશ્ન: ઘઉની દુંડીઓ સુકાય જાય છે અને દુંડી ખેચતા તેમાંથી ઈયળ નીકળે છે તો તેના માટે શું કરવું?

જવાબ : ઘઉ ત કે ૪ અઠવાડીયાના થાય ત્યારે અને ઘઉ ગાલે આવે ત્યારે તેના નિયંત્રણ માટે ઈયળના ઉપદ્રવની શરૂઆતથી જ એન્ડોસલ્ફાન ૨૦ મી.લી. અથવા કવીનાલફોસ ૨૦ મી.લી. અથવા મોનોક્રોટોફોસ ૧૨ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૧૦ મી.લી. પૈકી કોઈપણ એક દવાનો છંટકાવ ૧૦ લીટર પાણીમાં ભેળવી કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે.

પ્રશ્ન: ઘઉ સુકાય જાય છે અને તેને ઉપાડીને જોતા મુળમાં ઉધર્જ જોવા મળે છે તો તેનું નિયંત્રણ કેમ કરવું?

જવાબ : ૧. ઘઉમા ઉધર્જના નિયંત્રણ માટે વાવેતર વખતે પ્રતિ કિલો બીજ પ્રમાણે કવીનાલફોસ ૭.૫ મી.લી. અથવા કલોરપાયરીફોસ ૭.૫ મી.લી. પ્રમાણે બીજ માવજત આપી, બીજને છાંચે સુકવ્યા બાદ વાવેતર કરવું.

૨. એકલ દોકલ જગ્યાએ ઉપદ્રવ જોવા મળે તો કવીનાલફોસ ૨૦ મી.લી. અથવા કલોરપાયરીફોસ ૨૫ મી.લી. પૈકી કોઈપણ એક દવા ૧૦ લીટર પાણીમાં ભેળવીને છોડની આજુબાજુ જમીન પર પડે તે રીતે દ્રેન્ચીંગ કરવાથી આ જીવાતનું અસરકારક નિયંત્રણ થાય છે.

૩. ઉભા પાકમાં આખા બેતરમાં ઉપદ્રવ જણાય ત્યારે પીયતના પાણી સાથે ધોરીયામાં ટીએ ટીએ પડે તે રીતે હેકટર ૨.૫ લીટર પ્રમાણે કવીનાલફોસ અથવા કલોરપાયરીફોસ દવા આપવી.

પ્રશ્ન : ઘઉના પાકમાં નિંદશ નિયંત્રણ કેમ કરવું?

જવાબ : ઘઉના પાકમાં રાસાયણિક નિંદશ નિયંત્રણ માટે પેન્ડીમીથાલીન ૧ કિલો સેન્ટ્રિય તત્વ ૫૦૦ લીટર પાણીમાં ઓગાળીને વાવળી બાદ ઘઉ ઉગે તે પહેલા છાંટવી. ઉભા પાકમાં નિંદશ નિયંત્રણ કરવાનું થાય તો ઘઉનો પાક જયારે ૩૦ દિવસનો થાય ત્યારે ૨,૪-ડી દવા ૮૦૦ ગ્રામ સાંક્ષિકતત્વ/ હે પ્રમાણે ૫૦૦ લીટર પાણીમાં ઓગાળી ફ્લેટમેન નોઝલથી બે પિયત વચ્ચેના ગાળા દરમ્યાન છાંટવી.

પ્રશ્ન : ઘઉ ની કઈ કઈ જાતો નુ વાવેતર કરવું. (ટુકડા કે લોક-૧)

જવાબ : જી.ડબલ્યુ-૭૮૬, જી.ડબલ્યુ-૭૨૨, જી.ડબલ્યુ-૪૦૬, જી.ડબલ્યુ-૭૬૬ અને લોક-૧ જાતો માંથી અનુકૂળ કોઈપણ જાતનું વાવેતર કરી શકાય છે.

ગ્રન્થ : ઘઉને રાસાયણિક ખાતરો અને અન્ય કઈ બાબતોનું ધ્યાન રાખવું કે જેથી વધુ ઉત્પાદન મળે શકે?

જવાબ : ◆ વર્ષોથી મગફળી—ઘઉ પાક પદ્ધતિ પ્રમાણે વાવેતર થતું હોય તો વાવેતર પહેલા જમીનનું રાસાયણિક પૃથ્વકરણ કરાવી તેના રીપોર્ટ પ્રમાણે ખાતરો વાપરવા.

◆ ઝિક્સલ્ફેટ ની જરૂર પડે તો દર ર કે ઉ વર્ષે હેકટરે ૨૫ થી ૩૦ કિ.ગ્રા. પ્રમાણે ઉપયોગ કરવાથી ઘઉનું ઉત્પાદન સારું મળે છે.

◆ પાયાના ખાતર તરીકે ૧૨૦ કિલો નાઈટ્રોજન ૫૦ કિલો ફોસ્ફરસ અને જરૂર હોય તો ૫૦ કિલો પોટાશ નો ઉપયોગ કરવો.

◆ ભલામજ થેલ બિયારણ નો દર અને રર.૫ સે.મી. ના અંતરે વાવેતરનો આગ્રહ રાખવો.

◆ પિયત માફકસર આપવા.

◆ કયારા બહુજ લાંબા ન કરવા.

◆ ફળતી જાતો ને પવનના દિવસો માં પિયત ન આપવું.

◆ પાછલું પિયત બેચાઈને આપવાથી દાણા ચણકતા મળે છે.

ગ્રન્થ : ઘઉના પાન, થડ ઉપર બદામી રંગના ઉપસેલા ટપકાં જોવા મળે છે તો તેને કાખુમાં લેવાના ઉપાયો જણાવશો.

જવાબ : પાનની ઉપરની બાજુને છૂટાછવાયા નારંગી કે રતાશ પડતા ભૂખરા રંગના ટાંકડીના માથા જેવડા ગોળ ટપકા જોવા મળે છે. જે સમય જતાં લંબગોળ બને છે. આ રોગને પાનનો બદામી ગેરૂ કહે છે.

આના માટે રોગપ્રતિકારક જાત જીડબલ્યુ—૪૮૮, ૫૦૩, ૧૬૦, ૨૭૩, લોક—૧નું વાવેતર કરવું. અથવા ૦.૨ ટકા જાયનેબ કે મેન્કોલેબ ૧૦ લિટર પાણીમાં ર૫ ગ્રામ ઓગાળી ૧૫ દિવસના અંતરે બે થી ત્રણ છંટકાવ કરવા.

બાજરો

ગ્રન્થ : ખરીફ બાજરાના વાવેતરનો યોગ્ય સમય જણાવો.

જવાબ : ખરીફ બાજરાનું વાવેતર વાવણીલાયક વરસાદ થયે તુરત જ કરવું જોઈએ. કારણ કે સમયસરનું વાવેતર વધુ ઉત્પાદન આપે છે. તેમજ પાકમાં રોગજીવાતનો ઉપદ્રવ ઓછો રહે છે. તેમજ બાજરી ટૂંકા ગાળાનો પાક હોવાથી પછીનો પાક લેવા માટે જમીનને સમયસર ખાલી કરી શકાય. આમ, સમયસરની વાવણી બાજરાનું મહત્તમ ઉત્પાદન લેવા માટે એક અગત્યનું પરિબળ છે.

નોંધ : — જો વાવણીલાયક વરસાદ ર૫ જુલાઈના અંત પછી મોડા થાય તો વહેલી પાકતી જાત ગુ.હા. બાજરા—૫૮૮ ની વાવેતર માટે ભલામજ કરવામાં આવે છે.

પ્રશ્ન : સમયસર વાવણી કરવાથી થતાં ફાયદાઓ જણાવો.

જવાબ : બાજરાનું વાવેતર જો વાવેતર લાયક વરસાદ થતાં જ અથવા આઈ દિવસની અંદર કરવામાં આવે તો કુતુલ રોગની માત્રામાં સાર્થકતા પૂર્ણ ઘટાડો થાય છે. અને સાથે સાથે ગુંદરીયા અને અંગારીયાનાં રોગમાં ઘટાડો થાય છે. જેના લીધે દાણા અને ચારાનાં ઉત્પાદનમાં સાર્થકતા પૂર્ણ વધારો થાય છે. આમ, સમયસરની વાવણી કરવાથી વધારાનો ખર્ચ કર્યા સિવાય આવકમાં સારો એવો વધારો કરી શકાય છે.

પ્રશ્ન : બીજ માવજત એટલે શુ?

જવાબ : બીજ જન્ય રોગકારકનો નાશ કરવા, બીજાંકુરણ દરમ્યાન તેમજ બીજાંકુરણ પછી રોગકારકથી રક્ષણ આપવા અને બીજની સંગ્રહક શક્તિ સુધારવા બીજની વાવણી કે કોઠારમાં ભરતા પહેલા બીજને રાસાયણિક દવા, જૈવિક, ભૌતિક પદ્ધતિથી કેળવવાની રીતને બીજ માવજત કહે છે.

પ્રશ્ન : શા માટે બીજ માવજત આપવી ?

- ◆ બીજની સ્કુરણ શક્તિ વધારી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા વધારવી
- ◆ બીજની સંગ્રહ શક્તિ જાળવવી
- ◆ બીજ મારફતે ફેલાતા રોગ અટકાવવા
- ◆ બીજ અને જમીન જન્ય રોગકારકથી બીજનું તથા બીજાંકુરણનું રક્ષણ કરવા
- ◆ બીજની ગુણવત્તા જાળવી ઉત્પાદન વધારવા વગેરે

પ્રશ્ન : બાજરાનો પાક વાવતાં પહેલાં બિયારણને આપવાની બીજ માવજત વિશે જણાવો.

જવાબ : બાજરાનો પાક વાવતાં પહેલાં બિયારણને નીચે પ્રમાણે બીજ માવજત આપવી. કારણ કે બાજરામાં નીચે મુજબના મુખ્ય રોગો જોવા મળે છે. તેમાં દર્શાવ્યા મુજબની દવાનો પટ આપવો.

- ◆ કુતુલ: બીજને ૬ ગ્રામ/કિ.ગ્રા. એપ્રોન ઉપ એસ.ડી. અથવા રીડોમીલ ૮ ગ્રામ/કિ.ગ્રા. દવાનો પટ આપવો.
- ◆ અંગારીયો: રોગના નિયંત્રણ માટે બીજને પારા યુક્ત દવાનો પટ આપી વાવેતર કરવું.
- ◆ ગુંદરીયો: જો બિયારણમાં અરગટની પેશીઓ રહેલી હોય તો બિયારણને ૨૦ ટકા મીઠાનાં દ્બાવણમાં બોળી, પાણીથી ધોઈ, સુકવ્યા બાદ એક કિલો બિયારણ દીઠ ત્રણ ગ્રામ થાયરમ દવાનો બીજને પટ આપી વાવેતરનાં ઉપયોગમાં લેવું.
- ◆ હાઈશ્રીડ બાજરીના પાકમાં ચાર કિ.ગ્રા. બીજમાં ૨૦૦ ગ્રામ એઝોટોબેક્ટર એ.બી.એ.-૧ અથવા એઝોસ્પાઈરીલમ એ.એસ.-૧ કલ્યર વડે બીજ માવજત આપવાં આવે તો ભલામણ કરેલ નાઈટ્રોઝોનયુક્ત રાસાયણિક ખાતરનો અડધો જથ્થો (૪૦ કિ.ગ્રા./ ડે.) બચાવી શકાય છે.

◆ ફોસ્ફરસ ખાતરનો બચાવ કરવા ફોસ્ફેટ કલ્ચરનો પટ આપવો.

નોંધ :— જ્યારે બીજને એક કરતાં વધારે પટ આપવાનાં થતાં હોય ત્યારે એકાઈઆર શબ્દને ખાસ યાદ રાખવો. એટલે કે બીજને પ્રથમ ફૂગનાશક દવાનો પટ આપવો ત્યારબાદ જંતુનાશક દવાનો પટ આપવો અને ત્યારબાદ કલ્ચરનો પટ આપવો.

ગ્રેજન: ચોમાસુ બાજરાનાં વાવેતર માટે બાજરાની નવી સંકર જાતો વિષે માહિતી આપો.

જવાબ : મોટા ભાગના વિસ્તારમાં હાઈબ્રીડ બાજરાનું વાવેતર થતું હોઈ બાજરાનું દર વર્ષે નવું અને સર્ટીફિઝિડ બિયારણનો જ વાવેતર કરવાનો આગ્રહ રાખવો. સમગ્ર ગુજરાતમાં નીચે મુજબની જાતોનું વાવેતર કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે.

સંકર બાજરાની છાવમાં રોગ પ્રતિકારક બહાર પડેલ જાતોની માહિતી નીચે મુજબ છે.

ક્રમ ક્રમ ૧	સંકર જાતનું નામ	બલામણનું વર્ષ	બલામણની સ્થાનું	બલામણનો વિસ્તાર	નોંધ
1	જીઓચબી— ૫૫૮	૨૦૦૨	ખરીફ તથા ઉનાળું	ગુજરાત સહિત સમગ્ર ભારત	દાઢા અને ચારાની ઉચ્ચ ગુણવત્તા તથા વધુ ઉત્પાદન આપતી મધ્યમ મોડી પાકતી આ જાત ૭૮ થી ૮૮ દિવસે પાકે છે. કુતુલ અને અન્ય રોગ સામે રક્ષણ આપતી આ જાત ચોમાસામાં હેક્ટરે સરેરાશ ર૨૦૦ થી ૩૦૦૦ ક્રિ.ગ્રા. તેમજ ઉનાળામાં હેક્ટરે સરેરાશ દાઢાનું ૪૫૦૦ થી ૫૦૦૦ ક્રિ.ગ્રા. દાઢાનું ઉત્પાદન આપે છે.
2	જીઓચબી— ૫૨૬	૨૦૦૨	ઉનાળું તથા પુર્વ શિયાળું	ગુજરાત સહિત સમગ્ર ભારત	દાઢા અને ચારાનું વધુ ઉત્પાદન આપે છે. ગરમી અને ઠંડીમાં પણ દાઢા સારા બેસે છે. આ જાત ૭૫ થી ૮૦ દિવસે પાકે છે. કુતુલ અને અન્ય રોગ સામે રક્ષણ આપતી આ જાત હેક્ટરે સરેરાશ ૪૫૦૦ થી ૪૮૦૦ ક્રિ.ગ્રા. દાઢાનું ઉત્પાદન આપે છે.
3	જીઓચબી— ૫૭૭	૨૦૦૩	ખરીફ	ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો	દાઢા વધુ ઉત્પાદન આપે છે. લાંબુ હુંકુ ધરાવે છે. રોગ પ્રતિકારક જાત છે. દાઢાનો રંગ આકર્ષક છે. મધ્યમ સમયમાં પાકતી આ જાત ૭૫ થી ૮૦ દિવસે પાકે છે. કુતુલ અને અન્ય રોગ સામે રક્ષણ આપતી આ જાત ચોમાસામાં હેક્ટરે સરેરાશ ર૨૦૦૦ થી ૩૦૦૦ ક્રિ.ગ્રા.

					દાખાનું ઉત્પાદન આપે છે.	
૪	જીએચબી— ૫૩૮	૨૦૦૪	ખરીફ,	ગુજરાત, ઉનાળું તથા પુર્વ શિયાળું	રાજ્યાંસ અને હરિયાણા	વહેલી પાકતી, રોગ પ્રતિકારક, વધુ તથા ઓછા ઉષ્ણતામાન સામે સહનશીલ, વધુ કુટ, મધ્યમ ઉચ્ચાઈ ધરાવતી તથા દાખાનો રંગ ખૂબજ આકર્ષક છે. આ જાત જી થી ઉત્પાદન પાકે છે. કુતુલ અને અન્ય રોગ સામે રક્ષણ આપતી આ જાત ચોમાસામાં હેકટરે સરેરાશ ૨૭૦૦ થી ૩૦૦૦ કિ.ગ્રા. તેમજ પુર્વ રબી અને ઉનાળામાં હેકટરે સરેરાશ દાખાનું ૪૮૦૦ થી ૫૨૦૦ કિ.ગ્રા. દાખાનું ઉત્પાદન આપે છે.
૫	જીએચબી— ૭૧૬	૨૦૦૫	ખરીફ	ગુજરાત, રાજ્યાંસ અને હરિયાણા		વહેલી પાકતી, રોગ પ્રતિકારક, વધુ તથા ઓછા ઉષ્ણતામાન સામે સહનશીલ, હુંડા ઉપર મુંછો ધરાવતી, વધુ કુટ, મધ્યમ ઉચ્ચાઈ ધરાવતી તથા દાખાનો રંગ ખૂબજ આકર્ષક છે. આ જાત જી થી ઉત્પાદન પાકે છે. કુતુલ અને અન્ય રોગ સામે રક્ષણ આપતી આ જાત ચોમાસામાં હેકટરે સરેરાશ ૨૮૦૦ થી ૩૨૦૦ કિ.ગ્રા. કિ.ગ્રા. દાખાનું ઉત્પાદન આપે છે.
૬	જીએચબી— ૭૩૨	૨૦૦૭	ખરીફ	ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો		દાખા વધુ ઉત્પાદન આપે છે. મધ્યમ અને જાહુ હુંડુ ધરાવે છે. રોગ પ્રતિકારક જાત છે. દાખાનો રંગ આકર્ષક છે. મધ્યમ વહેલી પાકે છે. આ જાત જી થી ૮૨ દિવસે પાકે છે. કુતુલ અને અન્ય રોગ સામે રક્ષણ આપતી આ જાત ચોમાસામાં હેકટરે સરેરાશ ૩૦૦૦ થી ૩૪૦૦ કિ.ગ્રા. કિ.ગ્રા. દાખાનું ઉત્પાદન આપે છે.
૭	જીએચબી— ૭૪૪	૨૦૦૭	ખરીફ	ગુજરાત સહિત ઉત્તર ભારતના રાજ્યો		દાખા વધુ ઉત્પાદન આપે છે. મધ્યમ અને જાહુ હુંડુ ધરાવે છે. દાખાનો રંગ આકર્ષક છે. રોગ સામે પ્રતિકારક છે. મધ્યમ સમથમાં પાકતી આ જાત જી થી ૮૦ દિવસે પાકે છે. કુતુલ અને અન્ય રોગ સામે રક્ષણ આપતી આ જાત ચોમાસામાં હેકટરે સરેરાશ ૩૦૦૦ થી ૩૨૦૦ કિ.ગ્રા. કિ.ગ્રા. દાખાનું ઉત્પાદન આપે છે.

ગ્રન્ધ: બાજરાના પાકનાં વાવેતર માટે જમીનની પસંદગી અને પ્રાથમિક તૈયારી કરવાની માહિતી આપો.

જવાબ : બાજરાના પાકને ગોરાળુ, મધ્યમકાળી કે બેસર, સારી નિતારવાળી જમીન વધુ માફક આવે છે. હળની એક કે બે ખેડ તથા કળિયાની બે કે ત્રણ ખેડ કરી જમીન સમતલ અને ભરભરી બનાવવી. આગલા પાકનાં જડીયા મૂળીયા વીણીને હેક્ટર દીઠ ૧૦ ટન છાણિયું ખાતર, પ્રાથમિક ખેડ પહેલાં છાંટો અને ખેડ દ્વારા જમીનમાં બેળવો અથવા ચાસે ખાતર ભરો. જમીનમાં ૫૦ સે.મીના ચાસ ખોલી. પાયાના ખાતર તરીકે ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન (૫૦ કિ.ગ્રા. યુરીયા) અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ (૮૭ કિ.ગ્રા. ડી.એ.પી) બીજ વાવતાં પહેલાં દંતાળથી ચાસમાં ૭.૪ સે.મી. ઉંડે આપવું.

ગ્રન્ધ: ચોમાસું બાજરીની વાવેતરની રીત જણાવો

જવાબ: સામાન્ય જમીન માટે બિયારણનો દર ૪.૦ કિ.ગ્રા./હેક્ટર છે. જો જમીન નબળી, શારીય, શારીય ભાસ્મીક કે ભાસ્મીક જમીન હોય તો બિયારણનો દર ૬ કિ.ગ્રા./હેક્ટર રાખવો. વાવેતર અંતર બે હાર વચ્ચે ૫૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૦—૧૨ સે.મી. રાખી છોડની પારવણી કરવી. પરિણામે હેક્ટર દીઠ ૧.૫૦ થી ૧.૭૫ લાખ છોડનું પ્રમાણ જળવાઈ રહે. બાજરાનું બિયારણ નાનું હોવાથી જમીનમાં ૪ સે.મી. થી ૭૫ ન જાય તે રીતે વાવેતર કરવું.

ગ્રન્ધ : ચોમાસુ પાકનું વધુ ઉત્પાદન મેળવવા ખાતરની વૈજ્ઞાનિક ભલામણ વિષે માહિતી આપો.

જવાબ : છાણિયું/ક્રમોસ્ટ ખાતર :— ૧૦ ટન હેક્ટર દીઠ પ્રાથમિક ખેડ વખતે અથવા ચાસે ભરીને આપવું

રાસાયણિક ખાતર : કુલ જરૂરિયાત હેક્ટર દીઠ ૮૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપો.

રાસાયણિક ખાતર આપવાની પદ્ધતિ :—

અડધો નાઈટ્રોજન અને બધો જ ફોસ્ફરસ ખાતરનો જથ્થો વાવેતર અગ્રાઉ ચાસમાં પાયાના ખાતર તરીકે આપવું. બાકીનો અડધો નાઈટ્રોજન પાક જ્યારે એક માસનો થાય ત્યારે નિંદામણ અને પારવણી બાદ જમીનમાં દંતાળથી છોડથી ૨૦—૨૫ સે.મી. દૂર અને ૭—૮ સે.મી. ઉડાઈએ આપવા. જો જમીનમાં સૂક્ષ્મ તત્વોની ઉષાપ હોય તે તેને નાખૂદ કરવા સૂક્ષ્મ તત્વોનાં ખાતરોને જમીન પૃથ્વીકરણનાં આધારે ઉપયોગ કરવો.

ગ્રન્ધ : ચોમાસુ બાજરાનાં પાકમાં વાવણી બાદ કર્દ કર્દ માવજતો આપવી તેની વિગતવાર જાણકારી આપશો.

જવાબ : પારવણી :— બાજરાનાં પાકમાં પારવણી તે એક અગત્યનું ખેતી કાર્ય છે. કારણ કે પાવણી

કુવારા આપણે હેક્ટર દીઠ પૂરતા છોડની સંખ્યાની જગ્યાવણી કરી શકીએ છીએ. અને પારવણી કરવાથી છોડ દીઠ ફૂટની સંખ્યા વધારે મળતી હોવાથી તેની સીધી અસર પાક ઉત્પાદન પર પડે છે. માટે બાજરાનો પાક જ્યારે ૧૫–૨૦ દિવસનો થાય ત્યારે હારમાં બે છોડ વચ્ચેનું અંતર ૧૦–૧૨ સે.મી. જગ્યાવાઈ રહે તે પ્રમાણે અચુક પારવણી કરવી. પારવણી વખતે વધારાનાં નબળા અને રોગ–જીવાત લાગેલા છોડ કાઢી નાખવા. પારવણી દરમ્યાન જો હારમાં ખાલા હોય તો સારા અને તંદુરસ્ત છોડ કુવારા જમીનમાં ભેજ હોય તો ખાલા પૂરી ટેવા. જેથી કરી હેક્ટર દીઠ છોડની સંખ્યા પૂરતી જગ્યાવાઈ રહે.

નિંદામણ અને આંતરખેડ :

બાજરાનાં પાકને ત્રણ હાથ નિંદામણ ૧૫ દિવસનાં અંતરે કરી કુલ ૪૫ દિવસ સુધી પાકને નિંદામણમુક્ત રાખવો. પાક ઉગ્યા બાદના દશેક દિવસથી પાક નિંઘલે ત્યાં સુધીમાં પાકમાં નિંદામણ નિયંત્રણ માટે તેમજ જમીનને ભરભરી રાખવા માટે બે થી ત્રણ આંતરખેડ કરવી.

મજૂરોની અછતવાળા વિસ્તારમાં બાજરાનાં પાકોના વાવેતર બાદ અને ઉગ્ગાવા પહેલાં નિંદામણનાશક દવા એટ્રાજીન ૦.૫ સાંક્રિય તત્વ/હેક્ટરે ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે.

પિયત :-

સામાન્ય રીતે બાજરાનો પાક ચોમાસામાં વરસાદ આધારિત લેવામાં આવે છે. પરિણામે પિયત આપવાની જરૂરિયાત રહેતી નથી. પરંતુ જો વરસાદની જેંચ જણાય તો એક જીવનરક્ષક પિયત આપવાની ભલામણ કરવામાં આવે છે.

પ્રેણઃ બાજરામાં આવતા મુખ્ય રોગો ક્યાં કયા છે?

જવાબ: બાજરાના પાકમાં કુતુલ(બાવો), અંગારીયો, ગુંદરીયો અને પાનનાં ટપકાના રોગો મુખ્ય છે.

પ્રેણઃ કુતુલ રોગ કરી ઝાંખુમાં વધારે થાય છે?

જવાબ: કુતુલ રોગનાં લક્ષણો ખાસ કરીને બે અવસ્થાઓ જોવા મળે છે ઘરૂ અવસ્થાએ અને દુંડા અવસ્થાએ. ઘરૂ અવસ્થા: પાન પીળુ પડે છે પાનની નીચેની સપાટીએ ભેજવાળા વાતાવરણમાં સફેદ પાવડર જોવા મળે છે. વધુ લેજમાં પાનની ઉપરની સપાટીએ પણ જોવા મળે છે. છોડમાં ફુટ વધે છે અને છોડ સાવરણી બુઝી જેવો લાગે છે. છોડ દૂરથી પીળો દેખાય છે. અને વધુ રોગ પરિસ્થિતિમાં છોડ સુકાય મરી જાય છે.

પ્રેણઃ કુતુલ રોગના લક્ષણો કયા કયા છે. આપણે કેમ ઓળખી શકીએ?

જવાબ: કુતુલ રોગનાં લક્ષણો ખાસ કરીને બે અવસ્થાઓ જોવા મળે છે ઘરૂ અવસ્થાએ અને દુંડા અવસ્થાએ.

ઘરૂ અવસ્થા: પાન પીળુ પડે છે પાનની નીચેની સપાટીએ ભેજવાળા વાતાવરણમાં સફેદ પાવડર જોવા મળે છે. વધુ લેજમાં પાનની ઉપરની સપાટીએ પણ જોવા મળે છે. છોડમાં ફુટ વધે છે અને છોડ સાવરણી બુઝી જેવો લાગે છે. છોડ દૂરથી પીળો દેખાય છે. અને વધુ રોગ પરિસ્થિતિમાં છોડ સુકાય મરી જાય છે.

હુંડા અવસ્થા : હુંડામાં દાઢા ન બેસતા, નાના વાંકડીયા સહેજ લાંબા ગોળ લીલા પાન જેવી ફુટ નીકળે છે. અને જેને લીધે હુંડાનો આકાર સાવરણી જેવો દેખાય છે. ઘણી વખત હુંડામાં અડધા ભાગમાં દાઢા અને બાકીનાં ભાગમાં લીલી ફુટ જોવા મળે છે.

પ્રશ્ન : સંકર બાજરાની કુતુલ રોગ પ્રતિકારક જાતો કહેશો?

જવાબ : સંકર બાજરાની કુતુલ રોગ પ્રતિકારક જાતોમાં જી.એચ.બી.-૫૫૮, ૫૩૮, ૫૭૭, ૭૧૮ અને ૫૨૬ છે.

પ્રશ્ન : કુતુલ રોગ અટકાવવા માટે ક્યા ક્યા પગલા લેવા જોઈએ?

જવાબ : કુતુલ રોગ અટકાવવા માટે નીચે પ્રમાણેના પગલા લેવા જોઈએ

૧. રોગ પ્રતિકારક સંકર બાજરાની જાતોનું વાવેતર કરવું.
૨. બીયારણને એપ્રોન ઉપ એસ.ડી. ફ ગ્રામ/કિ.ગ્રા. અથવા રીડોમીલ એમ્પ્લેડ-૭૨ ટ્રેન/કિ.ગ્રા. પ્રમાણે દવાનો બીજને પટ આપી વાવેતર કરવું.
૩. પાક ફેરબદલી અપનાવવી.

પ્રશ્ન : અંગારીયો અને ગુંદરીયો રોગ કઈ પરિસ્થિતિમાં આવે છે?

જવાબ : આ રોગ ભેજવાળા વાતાવરણમાં અને હુંડા અવસ્થાએ જોવા મળે છે.

પ્રશ્ન : અંગારીયા રોગને કઈ રીતે ઓળખી શકાય?

જવાબ : અંગારીયા રોગમાં હુંડા અવસ્થાએ દાઢાની જગ્યાએ કાળી ભૂકીથી ભરેલા દાઢા જોવા મળે છે દાઢા શરૂઆતમાં લીલા ચણકતા રંગના અને સામાન્ય દાઢા કરતા મોટા કદના જોવા મળે છે. પાછલી અવસ્થાએ આવા દાઢા ભૂખરા થી કાળા રંગના થઈ તુટે છે અને જેમાંથી કાળી ભૂકી જેવો પાવડર નીકળે છે.

પ્રશ્ન : અંગારીયા રોગનું નિયંત્રણ કેવી રીતે કરવું?

જવાબ : આ રોગને અટકાવવાં માટે ખાસ રોગ પ્રતિકારક સંકર બાજરાની જાતોનું વાવેતર કરવું જોઈએ. આમ છતાં આ રોગ થોડા પ્રમાણમાં હોય ત્યારે જ હુંડા અવસ્થાએ થાયરમ (કુમાન એલ) એટલે કે ૨ ગ્રામ દવા/ ૧લીટર પાણીના પ્રમાણમાં ઓગાળી છંટકાવ કરવો.

પ્રશ્ન: ગુંડદીયા રોગને ખેતરમાં કેવી રીતે ઓળખી શકાય છે?

જવાબ: આ રોગ ખેતરમાં સહેલાઈથી ઓળખી શકાય છે. કુંડામાં થૂલી કુલ અવસ્થાએ ગુંડર જેવો ચીકણો પ્રવાહી જરે છે કુંડામાં આ પ્રવાહી સુકાતા તેમાંથી ભૂખરી કાળી કઠણ પેશીઓ બને છે જે એરી હોય છે.

પ્રશ્ન: બાજરીમાં ગેરુ રોગ આવતા ક્યા પગલા લેવા જોઈએ?

જવાબ: રોગ પ્રતિકારક સંકર બાજરાની જાતોનું વાવેતર કરવું. છતાં ખેતરમાં આ રોગ વહેલા જોવા મળતો રોગને અટકાવવાં મેન્કોઝેબ અથવા થાયરમ નામની દવા ૨.૫ ગ્રામ દવા/ ૧લીટર પાણીના પ્રમાણમાં ઓગાળી જરૂર પ્રમાણો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

પ્રશ્ન: બાજરાના પાકમાં પાનના ટપકાં પડે તો શું કરવું?

જવાબ: રોગ પ્રતિકારક સંકર બાજરાની જાતોનું વાવેતર કરવું. આમ છતાં રોગપાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે તો કાર્બન્ડાલીમ નામની દવાં ૧ ગ્રામ/૧લીટર પાણીના પ્રમાણમાં ઓગાળી જરૂર પ્રમાણો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા.

પ્રશ્ન : બાજરાના પાકની મુખ્ય જીવાતો કઈ કઈ?

જવાબ: બાજરાની મુખ્ય જીવાતો નીચે પ્રમાણો છે.

- | | |
|------------------|-------------------|
| (૧) સાંઠાની માખી | (૨) ગાભમારાની ઈયળ |
| (૩) કુંડાની ઈયળો | (૪) કાંસીયા |

પ્રશ્ન: બાજરાની સાંઠાની માખીનો ઉપદ્રવ પાકની કઈ અવસ્થાએ જોવા મળે છે?

જવાબ: ખાસ કરીને ઘરું અવસ્થામાં પાક એકાદ મહીનાનો થાય ત્યાં સુધી વચ્ચે દુંખ કોરીને સુકૃતીને નુકશાન કરે છે. ઉપરાંત કુંડા અવસ્થાએ પણ નુકશાન કરે છે.

પ્રશ્ન : સાંઠાની માખીને નિયંત્રણ માટેના ઉપાયો ક્યા ક્યા?

જવાબ : બાજરાનાં બિયારણનો દર થોડો વધારે એટલે કે ૫.૦ કિ.ગ્રા./છે. મુજબ રાખી પારવણી વખતે સાંઠાની માખીથી નુકશાન પામેલા છોડ ખાસ દૂર કરી તેનો નાશ કરવો. ઉપદ્રવ ૮% જેટલો જોવા મળે ત્યારે એન્ડોસલ્ફાન ૦.૦૭ %, કવીનાલ્ફોસ ૦.૦૫%, મિથાઈલઓ-ડિમેટોન-૦.૦૫% પૈકી કોઈ પણ એક દવાનો છંટકાવ ઘરું અવસ્થાએ કરવો. અથવા મિથાઈલ પેરેથીઓન ૨% ભૂકી ૨૫ કિ.ગ્રા./છે. મુજબ છંટકાવ કરવો. નિમાર્ક ૦.૩ ટકા અથવા લીબોડીનું તેલ ૦.૦૫ % ૪ ગ્રામ સાબુ/લીટર મુજબ દ્રાવણ બનાવી તેનો છંટકાવ કરવો.

પ્રશ્ન : ગાભમારાની ઈયળ કઈ રીતે નુકશાન કરે છે ?

જવાબ : આ જીવાતની ઈયળ પાનની ભૂગળીમાં દાખલ થઈ સાંઠામાં દાખલ થાય છે તેથી સાંઠાની વચ્ચેલી કુંખ સુકાઈ જાય છે. કુંડા અવસ્થાએ ઈયળ કુંડાની ડાંડીમાં દાખલ થઈ તેને કોરી ખાય છે. જેથી કુંડા સુકાઈ જાય છે. ત્યાં દાણા બિલકુલ ભરાતા નથી. '

પ્રશ્ન : ગાભમારાની ઈયળને કાબુમાં લેવાના ઉપાયો કયા કયા છે ?

જવાબ : સાંઠાની માખીના નિયંત્રણ માટેના પગલામાં જણાવેલ કિટનાશક દવાઓનો પાક ઉગાવા બાદ ૨૦ દિવસે તથા બીજો છંટકાવ નિંઘલ પહેલા કરવાની ભલામણ છે.

પ્રશ્ન : કુંડાની ઈયળો કઈ રીતે નુકશાન કરે છે.

જવાબ : કુંડા અવસ્થાએ નાની ઈયળો શરૂમાં રેશમી તાંત્રણ ખાય છે. ત્યારબાદ દૂધીયા દાણા ખાયને નુકશાન કરે છે. ઈયળો થુલી નીચે રહીને દાણા ખાઈને નુકશાન કરે છે,

પ્રશ્ન : કુંડાની ઈયળને કાબુમાં લેવાના ઉપાયો જણાવો.

જવાબ : (૧) પાક નિંઘલ ઉપર આવે ત્યારે પ્રકાશ પીજરફ્ફારા પુષ્ટ હુદા એકઠા કરી તેનો નાશ કરવો.
(૨) લીલી ઈયળનો કેરોમોન ટ્રેપનો સામુહિક ધોરણે ઉપયોગ કરી એકઠા થયેલ નર હુદાનો નાશ કરવો.
(૩) ઈયળોનું પ્રમાણ વિશેષ માત્રામાં જણાય તો પવનની ગતિ ધીમી હોય તે સમયે મિથાઈલ પેરેથીઓન ૨% ભુકીનો ૨૫ કિ.ગ્રा./હે. મુજબ છંટકાવ કરવો.

પ્રશ્ન : કાંસીયા કઈ રીતે નુકશાન કરે છે?

જવાબ : નિંઘલ બાદ જ્યારે કુંડામાં થુલી આવે છે. ત્યારે કાંસીયા થુલી તથા પરાગરજ ખાઈને તથા કુંડાના ફૂલના અન્ય ભાગોને ખાઈને નુકશાન કરે છે. આ ઉપરાંત અરગટ રોગ ને ફેલાવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે.

પ્રશ્ન : કાંસીયાનું નિયંત્રણ કઈ રીતે કરવું ?

જવાબ : (૧) પ્રકાશ પિંજર ૧ પ્રતિ હેક્ટર પ્રમાણે સામુહિક રીતે ઉપયોગ કરવો.
(૨) કુંડા ઉપરના કાંસીયા કેરોસીન વાળા પાણીમાં ખંખેરી લઈ તેનો નાશ કરવો.
(૩) મિથાઈલ પેરેથીઓન ૨% ભુકીનો ૨૫ કિ.ગ્રા./હે. મુજબ છંટકાવ કરવો.

પ્રશ્ન : કાપણી માટે શી શી કાળજી લેવી તે જણાવશો.

જવાબ : પાક જ્યારે ૮૦ થી ૮૫ દિવસનો થાય ત્યારે અને કુંડામાં દાણાનો રંગ ભુખરો થાય તથા કુંડા

દ્વારા દાખા છુટા પડી જવા લાગે ત્યારે સમયસર કાપણી કરી લેવી જોઈએ. તુંડા બરાબર તપાવી, દાખા છુટા પાડી, દાખાને બરાબર સાફ કરી તથા સુકવી વધારાનો ભેજ નીકળી ગયા બાદ સંગ્રહ માટે ઘોંય જગ્યાએ રાખવાં.

ગ્રન્ઝન : બાજરાના પાકમાં જુદા જુદા જેત આબોહવાકીય વિસ્તાર પ્રમાણેની પાક પદ્ધતિ અંગેની ભલામણો:

- જવાબ :** ૧. જો બેડૂતો બાજરા—ઘઉ પાક પદ્ધતિ અપનાવતાં હોય તો બેડૂતોને વધુ આર્થિક વળતર મેળવવા બંને પાકમાં ભલામણ કરેલ રાસાયણિક ખાતરનો જથ્થો આપવા સલાહ આપવામાં આવે છે.
૨. જો બેડૂતો બાજરો—રાયડો પાક—પદ્ધતિ અપનાવતાં હોય તો મહત્તમ નફો મેળવવા બાજરાનાં પાકને ૧૦૦% ભલામણ કરેલ રાસાયણિક ખાતરનાં ડોઝ સાથે ૧૦ ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટરે આપવું જયારે રાયડાનાં પાકને ફક્ત ૫૦% ભલામણ કરેલ ખાતરનો ડોઝ પ્રતિ હેક્ટરે આપવા ભલામણ કરવામાં આવે છે.
- ◆ બાજરાનાં પાકમાં જો જમીનમાં ઉપલબ્ધ ફોસ્ફરસની માત્રા વધારે હોય તો ફોસ્ફરસ આપવાની જરૂરિયાત નથી.
- ◆ બાજરાનાં બિયારણને જો એઝેટોબેક્ટર કે એઝોસ્પાયરીલમની બીજ માવજત આપી વાવવામાં આવેલ હોય તો ભલામણ કરેલ નાઈટ્રોજનયુક્ત રાસાયણિકખાતરનો અડધો જથ્થો બચાવી શકાય છે.

ઉનાળુ અને પુર્વ-રવી

આગળ જોયા પ્રમાણો ગુજરાતમાં જ્યાં પિયતની પુરતી સગવડતાં છે ત્યાં બાજરાનો પાક ટુંકા ગાળાનો હોવાથી તેનું વાવેતર વિસ્તાર વધતો જાય છે.

સામાન્ય રીતે ઉનાળુ / પુર્વ રવી ઋષ્ટુમાં બાજરીનાં દાખાનું ઉત્પાદન ખરીફ ઋતુમાની સરખામણીમાં લગભગ બે થી અઢી ગણ્ણુ વધારે મળે છે. કારણ કે ઉનાળુ / પુર્વ રવી ઋષ્ટુમાં ખેતી કાંધો જેવા કે ખેડ, ખાતર, નિંદામણ, આંતરખેડ, પિયત વગેરે સમયસર કરી શકાય છે. તેમજ વાતાવરણમાં સાનુકુળ પરિબળોને કારણે ખરીફ ઋતુના પ્રમાણમાં રોગ જીવાતનો ઉપદ્રવ પણ નહિંવત રહેતો હોય છે.

ગ્રન્ઝન : ગુજરાતમાં ક્યા વિસ્તારમાં ઉનાળુ / પુર્વ રવી ઋષ્ટુમાં બાજરાનું વાવેતર કરવામાં આવે છે.

જવાબ : ઉનાળુ બાજરીનું વાવેતર મુખ્યત્વે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કરવામાં આવે છે. જયારે પુર્વ રવી ઋષ્ટુમાં બાજરીનું વાવેતર સૌરાષ્ટ્રના દરીયા કાંઠાનાં વિસ્તારમાં કરવામાં આવે છે.

પ્રશ્ન : ઉનાળું બાજરીના વાવેતરના સમય અંગે માહિતી આપો.

જવાબ : ઉનાળું બાજરીનું વાવેતર ફેલ્બુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં હંડી ઓછી થયે કરી દેવાની ભલામણ છે. જો વાતાવરણમાં વધુ હંડી હોય અને વાવેતર કરવામાં આવે તો વાવેતર કરેલ બીજાનું અંકુરણ મોહુ અને ધીમુ થાય છે. તે જ રીતે જો વાવેતર મોહુ કરવામાં આવે તો પાક થુલીમાં હોય ત્યારે વધુ ગરમી લાગતાં દાઢા ઓછા બેસે છે. તેમજ પાક તૈયાર થાય ત્યારે ચોમાસું શરૂ થઈ જવાની શક્યતા રહે છે. આમ, ઉનાળું બાજરાનું વાવેતર ૧૫ ફેલ્બુઆરી થી ૧૫ માર્ચ સુધી કરવું હિતાવહ છે. ત્યારબાદ વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન ઘટે છે.

પ્રશ્ન : ઉનાળું બાજરાનું વાવેતર ફેરરોપણીથી કરી શકાય?

જવાબ : ઉનાળું બાજરીનું ફેરરોપણીથી વાવેતર કરી શકાય છે. જેમાં બાજરીનું ઘરું બનાવીને ૨૦ થી ૩૦ દિવસના ઘરુંની ફેરરોપણી કરીને વાવેતર કરવાથી વધુ ઉત્પાદન મળે છે. ફેરરોપણી વખતે એઝોસ્પારીલમ કલ્યાર ચાર પેકેટ ૧૫ લિટર પાણીમાં બેળવીને તે દ્રાવણમાં ઘરુંને જમીનમાં ચોપતા પહેલા ૧૫ થી ૨૦ મીનીટ બોળી રાખવાં અને પછી ચોપવાથી હેક્ટરે ભલામણ કરતા ૪૦ કિ.ગ્રા. નાઈટ્રોજન ઓછો આપવામાં આવે તો પણ વધુ ઉત્પાદન મળે છે.

પ્રશ્ન : પૂર્વ—રવી બાજરીનું વાવેતર કરવાનો સમય જણાવશો.

જવાબ : પૂર્વ—રવી બાજરીનું વાવેતર ૧૫ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબર સુધી કરી દેવું હિતાવહ છે. મોહુ વાવેતર કરવાથી દાઢા બેસવાનાં સમયે તાપમાન નીચું જવાથી ઝૂંડામાં દાઢા ઓછા બેસે છે. જેને કારણે ઉત્પાદન પર માઠી અસર પડે છે.

પ્રશ્ન : ઉનાળું/પૂર્વ—રવી ઋસ્તુમાં બાજરાની જાતોની પસંદગી માટેની માહિતી આપો.

જવાબ : બાજરા સંશોધન કેન્દ્ર, જુ.કૃ.પુ. જામનગર પર સતત ચાલતાં ધનિષ્ટ સંશોધનના પરિણામે ઉનાળું ઋસ્તુ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ હાઈબ્રિડ જાતો જી.એચ.બી.પર્ફ, જી.એચ.બી.—૫૮૮ અને જી.એચ.બી.પ૪૮ નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે. તેજ રીતે પૂર્વ—રવી ઋસ્તુ માટે ખાસ તૈયાર કરવામાં આવેલ હાઈબ્રિડ જાતો જી.એચ.બી.પર્ફ અથવા જી.એચ.બી.—૫૮૮ નું વાવેતર કરવાની ભલામણ કરવામાં આવે છે.

પ્રશ્ન : ઉનાળું/પૂર્વ રવી બાજરાનાં વાવેતર અંતરની ભલામણ જણાવશો.

જવાબ : ઉનાળું/પૂર્વ રવી બાજરાનાં વાવેતર માટે બે હાર વચ્ચે ૪૫ સે.મી. અને બે છોડ વચ્ચે ૧૨ થી ૧૫ સે.મી. અંતરે પારવણી કરી હેક્ટર દીઠ ૧.૭૫ થી ૨.૦૦ લાખ છોડની સંખ્યા જાળવવી જરૂરી છે.

પ્રશ્ન : ઉનાળું બાજરાના પાકમાં કેટલું ખાતર આપવું તેની માહિતી આપશો.

જવાબ : ઉનાળું ઋસુમાં પિયત આપીને સારી પરિસ્થિતિમાં પાક લઈએ છીએ એટલે ઉનાળું બાજરીનો ખાતરનો ડોઝ પણ ખરીફ બાજરા કરતાં વધારે હોય છે. જમીન તૈયાર કરતી વખતે ૧૦ ટન છાણિયું ખાતર પ્રતિ હેક્ટારે જમીનમાં ભેળવવું અથવા ચાસે ભરવું. કુલ ખાતરની જરૂરિયાત ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ પ્રતિ હેક્ટારે આપવાની ભલામણ છે. (૧૩૦ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૮૦ કિ.ગ્રા. યુરીયા)

- ◆ અડધો નાઈટ્રોજન અને બધો જ ફોસ્ફરસ વાવેતર અગાઉ ચાસમાં પાયાના ખાતર તરીકે આપવું.
- ◆ બાકીના અડધો નાઈટ્રોજનનો જથ્થો પાક એક માસનો થાય ત્યારે નિંદામણ અને પારવણી કર્યા બાદ પૂર્તિ ખાતર તરીકે આપવું.
- ◆ ઉત્તર ગુજરાતમાં ઉનાળું બાજરામાં ૧૨૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૬૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ કરવામાં આવે છે. (૧૩૦ કિ.ગ્રા. ડી.એ.પી. અને ૮૦ કિ.ગ્રા. યુરીયા)

પ્રશ્ન : ઉનાળું બાજરામાં કેટલા પિયત આપવા તે વિશે માહિતી આપો.

જવાબ : ઉનાળું બાજરાનાં પાકમાં પિયત કર્યારે અને કેટલું આપવું તે ખૂબ અગત્યનું છે. સામાન્ય રીતે પિયતનો આધાર સ્થાનિક જમીનના પ્રકાર આબોહવા અને બેઠી પદ્ધતિ પર રહેલો છે. ઉનાળ માં સામાન્ય રીતે બાજરાનાં પાકને ૧૧ પિયત ૭–૮ દિવસના અંતરે આપવા ભલામણ કરવામાં આવે છે. બાજરાના પાકમાં ખાસ કરીને પારવણી બાદ, થુલી અવસ્થાએ, દુધીયા દાઢા ભરાતાં હોય ત્યારે પિયતની જેચ ન આવે તેની ખાસ કાળજી લેવી. બાજરાનો પાક ત૦ દિવસનો થાય ત્યારે પિયત આપ્યા બાદ જ્યારે વરાપ થાય ત્યારે જ પૂર્તિ ખાતર આપવું. અવાર–નવાર પિયત આપવાથી વાતાવરણ ઠંડુ અને બેજ યુક્ત રહે છે. જેથી દાઢાનો ભરાવો સારો થાય છે.

પ્રશ્ન : બાજરા સાથે કયા કયા મિશ્ર પાક તથા આંતર પાક લઈ શકાય ?

જવાબ : ચોમાસુ બાજરા સાથે તુવેર, મગ, અડદ, ગુવાર, મઠ વગેરે માંથી એક અથવા એક થી વધારે પાકો મિશ્ર પાક તરીકે લઈ શકાય જ્યારે આંતર પાકોમાં બાજરી સાથે તુવેર, ૪ : ૧ અથવા ૨ : ૧ હારના પ્રમાણમાં વાવેતર કરી આંતર પાક તરીકે લઈ શકાય.

પ્રશ્ન : ઉત્તર ગુજરાત ખોત આબોહવા વિસ્તારમાં મિશ્ર પાક અંગેની ભલામણ જણાવો.

જવાબ : ખરીફ ઋસુમાં હાઈબ્રિડ બાજરા સાથે મગ/તુવેરનો મિશ્ર પાક લેવાથી કુલ આવકમાં વધારો કરી શકાય છે. આ ઉપરાંત બાજરા સાથે ગુવારનો ૨ : ૧ હારના પ્રમાણમાં આંતર પાક લેવાથી પણ ફાયદો થાય છે. પિયતની સગવડતાવાળા જેડૂતોને ચોમાસુ બાજરી વાવતાં જેડૂતોને

બાજરી—બટેટા—મગફળી પાકપદ્ધતિ એટલે કે ચોમાસામાં બાજરી, શિયાળામાં બટેટાં અને ઉનાળ માં મગફળીનું વાવેતર કરવા સલાહ આપવામાં આવે છે.

પ્રશ્ન: બાજરીના છોડમાં કુંડાની જગ્યાએ સાવરણી જેવું દેખાય છે તેને અટકાવવાના ઉપાયો જણાવશો.

જવાબ : (૧) ઘરૂ અવસ્થા : આ અવસ્થાએ રોગ લાગે તો છોડના પાનની નીચેની સપાટી પર સર્ફેટ ભુકી જોવા મળે છે. સમય જતા આવું પાન કથ્થાઈ રંગનું થઈ સુકથ્થાઈ જાય છે.

(૨) કુંડા અવસ્થા : આ રોગની કુગ સીસ્ટેમીક પ્રકારની હોઈ ઘરૂ અવસ્થામાં રોગ ન દેખાય તો ઘણી વખત કુંડા અવસ્થાએ રોગના ચિંહો જોવા મળે છે. કુંડામાં દાણાની જગ્યાએ નાના વાકરીયા લીલા રંગની પાનની ફૂટ થઈ હોય તેવું જણાય છે. આ પ્રકારની વિકૃતિને કારણે

પ્રશ્ન: બાજરીના કુંડામાં દાણાં બેસતી વખતે ચીકશુંગ્રવાહી જોવા મળે છે તેને અટકાવવાના ઉપાયો જણાવશો.

જવાબ: આ રોગના નિયંત્રણ માટે નીચેના ઉપાયો હાથ ધરવા.

૧. જો બિયારણમાં કાળી પેશી જોવા મળે તો વાવતા પહેલા ૧૦ ટકા મીઠાના દ્રાવકમાં બોળી, ઉપર તરતી કુગની પેશીઓ અલગ તારવી, બિયારણને સ્વર્ચ પાણીથી ૨ થી ૩ વખત ધોઈ સૂકવી, વાવેતરનાં ઉપયોગમાં લેવું. કોઈપણ પારાયુક્ત દવાનો ત ગ્રામ/કિ.ગ્રા. બીજ પ્રમાણે પટ આપવો.

૨. કુંડા અવસ્થાએ ફૂલ સમયે કુગનાશક દવા જાયરમ ૦.૨ ટકા (કુમાન એલ.) એટલે કે ૨ ગ્રામ/લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

પ્રશ્ન: બાજરીના કુંડામાં દાણાની જગ્યાએ કાળી ભુકી ભરેલા લીલા રંગના દાણાં મોટા થયેલા જોવા મળે છે તે શું ? તેને અટકાવવાના ઉપાયો જણાવશો.

જવાબ: આ રોગ અંગારીયો નામે ઓળખાય છે. તેનાં નિયંત્રણના પગલા નીચે મુજબ છે.

૧. વાવણી લાયક વરસાદ થતાં સમયસર વાવેતર કરવાથી ઉપરોક્ત રોગોનું પ્રમાણ ઓછું રહે છે. મતલબકે વહેલા વાવેતરમાં રોગ ઓછો આવે છે. ચોમાસામાં ૧ પજુલાઈ બાદ બાજરીનું વાવેતર કરવું હિતાવહ નથી. મોહું વાવેતર કરવાથી ઉપરોક્ત રોગનું પ્રમાણ વધે છે.

૨. ઉનાળામાં ઉડી ખેડ કરી જમીન તપવા દેવી.

૩. પાક ફેરબદલી કરવી.